Tata Motors redefines the mid-SUV category with India's first SUV Coupé Reveals the Curvv Mumbai, Defining a though innovative designs plimented by premiu ew era in SUV design, that deliver great road performance." The Cur

new era in SUV design, Tata Motors, India's leading automotive manufacturer, today unveiled the Tata Curvy ICE and EV. Born of powerful philosophy, form and function, the Curvv is India's first SUV Curvy is India's first SUV Coupé. Exhibiting the new-age SUV typology, the Curvy artfully blends the toughness and practi-cality of an SUV with the elegance and sporty silhouette of a coupé. Launching on 7th August, the all-new Curvv will follow Tata Motors' strong multi-powertrain strategy and will be first available in its EV version which will soon be followed by its ICE counterpart.

Commenting on the unveil, Mr. Shailesh Chandra, Managing Director, Tata Motors Passenger Vehicles Ltd., and Tata Passenger Electric Mobility Ltd., said, "Tata Motors has pioneered the Indian SUV arena. What's more is that we have repeatedly disrupted the category

presence as well as enhanced functionality. The original Sierra, Safari, Nexon, Punch and Harrier are testament to this design led market leadership in SUVs. Taking this legacy forward and to fur-ther strengthen our SUV portfolio, we have once again broken the clutter in the effervescent and aspirational mid SUV category by introducing the Tata Curvy - India's first SUV Coupe - a disruptive design which democratizes the Coupe body style in the premium categories, providing best in segment performance and never before seen practicality. Further, Curvv is at the forefront of our multi powertrain strategy, with options across Petrol, Diesel and Electric powertrains. With the Curvv we will address a wide variety of needs of the mid SUV customers, providing them with a fresh and delightfully designed product com-

plimented by premium performance." The Curvv is a perfect blend of stunning design that captivates, practicality that empowers, and performance that exhilarates. The Curvv's SUV coupé body style, in contrast to the conventional boxy design that is common in the mid-SUV market, carries over the strong aerodynamic theme demonstrated in the concept show car, highlighting its strong character to the front and carrying it boldly through the vehicle. The raised ride height, tough cladding, and dynamic proportions contribute to its appeal. The Curvv's sharply sloping roofline allows it to efficiently slice through wind resistance, while its large wheels, high approach and departure angle, and increased ground clearance give it a planted and balanced stance. The SUV coupé will debut in two new color shades: Virtual Sunrise in the Curvv.ev and Gold Essence in the

Samsung Launches Galaxy Watch7, Watch Ultra, Buds3 Series in India GURUGRAM, Samata wider range of altitudes Titanium Silver. Ga

sung, India's largest consumer electronics brand, has announced exciting offers for consumers preordering its new Galaxy Buds3, Galaxy Buds3 Pro, Galaxy Watch7 and Galaxy Watch Ultra smartwatches. Galaxy Watch7 and Galaxy Watch Ultra expand the power of Galaxy AI to more people through wearables designed to provide endto-end wellness experienc-

es for everyone. Galaxy Watch Ultra the newest and most powerful addition to the Galaxy Watch portfolio – is designed for enhanced fitness experiences for next level achievements with ultimate intelligence and capabilities.

The Watch Ultra gets a new cushion design to enhance protection and visual completeness. It comes with Titanium Grade 4 frame and 10ATM water resistance and can operate for advanced fitness experiences like swimming in the ocean to cycling in ex-

treme environments.

With a newly added Quick Button, you can instantly initiate and control workouts and map other functions to suit your needs. In addition, you can activate an Emergency Siren for safety. Post-workout, check stats at a glance with dedicated watch faces for Galaxy Watch Ultra. With a peak brightness of 3,000 nits, Galaxy Watch Ultra also ensurés readability even in bright sun-light. For peace of mind during longer adventures, Galaxy Watch Ultra has the longest battery life within the Galaxy Watch line-up, offering up to 100 hours in Power Saving and 48 hours in Exercise Power Saving. Galaxy Watch Ultra will be available in a 47mm size in Titanium

Gray, Titanium White and

Titanium Silver. Galaxy Watch Ultra comes with a 3nm chipset. With Galaxy Watch7, you can accurately track over 100 workouts and build routines by combining various exercises with Workout Routine to achieve your goals. Receive a complete body and fitness snapshot with Body Composition for a comprehensive understanding of your body. In addition to the new advanced Galaxy Al algorithm for sleep analysis and get a deeper understanding of your heart health with Electrocardiogram (ECG) and Blood Pressure (BP) monitoring.

Customers who pre book the Galaxy Watch7 will get multi-bank cash-back worth INR 8000 or upgrade bonus worth INR 8000, while customers who pre book the Galaxy Watch Ultra will get multi-bank cashback worth INR 10000 or upgrade bonus worth

Business Brief |||

Sensex, Nifty trade lower on weak global cues

Mumbai, July 19 (IANS) Indian equity indices opened in the red on Friday following weak global cues from Asian peers. At 9:45 a.m., Sensex was at 81,196, down 146 points or 0.18 per cent and Nifty was down 75 points or 0.34 per cent, at 24,716. The broader market trend is negative. On the National Stock Exchange (NSE), 1651 shares are in red and 526 shares in green. Selling pressure is also seen in midcap and smallcap stocks. The Nifty Midcap 100 index is down 504 spirits and 102 pressure at 526 page 100. index is down 591 points or 1.03 per cent at 56,520 and the Nifty Smallcap 100 index is at 18,661 points, down 167 points or 0.89 per cent. Deven Mehata, Research Analyst at Choice Broking said, "Nifty can find support at 24,700 followed by 24,650 and 24,600. On the higher side, 24,850 can be an immediate resistance, followed by 24,900 and 25,000. "on Thursday, Infosys reported a good number compared to estimates. Infosys, Asian Paints, ITC, Nestle, HCL Tech, Kotak Mahindra Bank and HDFC Bank are the top gainers in the Sensex pack. Tech Mahindra, Tata Steel, UltraTech Cement, JSW Steel and Wipro are the top losers.

Despite being halfway through the current solar cycle, Sun is starting next

New Delhi, July 19 (IANS) Even though the Sun is just halfway through its current cycle, the first rumblings of its next 11-year solar cycle have been detected in sound waves within it, according to a team of researchers. This current cycle is presently reaching its apex, or solar maximum that occurs when the Sun's magnetic field flips and its poles swap places, until mid-2025. It impacts the Sun's surface activity, with sunspots, flares, and coronal mass ejections all increasing during solar maximum. This causes an increase in electromagnetic energy heading towards Earth, making auroras more visible and at lower altitudes. The current solar cycle, known as Cycle 25, began in 2019. It is not expected to end for another six years but researchers from the University of Birmingham have spotted the first signs that the next solar cycle is beginning. They presented the findings at the Royal Astronomical Society's National Assistance Astronomy in Hull.Dr. Rachel Howe, Helioseismology Research Fellow at the University of Birmingham, and her team have detected early signs of solar cycle 26 through internal sound waves in the Sun, revealing bands of faster and slower rotation. This pattern, observed using helioseismic data from GONG, MDI, and HMI since 1995, shows faster-moving material drifting toward the Equator before each solar cycle starts.

Retail sales surge in India amid high disposable

incomes, rising consumption New Delhi, July 19 (IANS) As household consumption expenditure on goods and services surged with rising disposable incomes, the country saw a significant 5 per cent growth in retail sales in the month of June. According to a survey by the Retailers Association of India (RAI), south India led the regional growth with 7 per cent spike, followed by north and east India at 5 per cent rise, respectively, and West India showing 4 per cent rise. The footwear and apparel and clothing sectors each registered a 4 per cent growth. "With the upcoming festival season and a

anticipate further improvement in consumer sentiment and retail sales," said Kumar Rajagopalan, CEO of RAI. The report showed a robust performance across various sectors, particularly in discretionary items, boosted by end-ofseason sales. According to a recent survey by the Min-istry of Statistics, house-hold consumption expenditure on goods and services is rising in both rural and urban areas. The monthly per capita household consumption in rural India jumped by over 40 per cent

Luxury homes worth crores selling like hot cakes in India this year higher luxury housing Matrix'. The primary luxury sales in H1 2024 due segment saw sales worth New Delhi, July 19 (IANS) Aligned with the Mumbai saw a growth of 14 per cent to 2,500

continuous momentum in the real estate industry, the sale of houses costing Rs 4 crore and above went up 27 per cent in the first half of this year.

According to the latest report by real estate consultant CBRE, India's luxury housing segment maintained strong sales growth, reaching total sales of around 8,500 luxury units compared to nearly 6,700 units in the same period of 2023. Delhi-NCR, Mumbai

and Hyderabad accounted for nearly 84 per cent of the total luxury housing sales across the top seven cities. While sales in Delhi-NCR surged 14 per cent to 3,300 units,

BOTH ARE SAME PERSON

JAYNEEL MAHENDRAKUMAR PATEL

in my Aadhar Card,

PATEL JAINIL MAHENDRABHAI

in Election Card and

(Son of: MAHENDRA) in

Driving License by mistake.

I Solemnly declare and confirm

that my name Both are same

person and I known as

JAYNEEL MAHENDRAKUMAR PATEL.

Address: 8, Rudravatika Society

Sindhubhayan Road.

Thaltej, Ahmedabad.

PUBLIC NOTICE

IN THE HIGH COURT OF GUJARAT AT AHMEDABAD R/RECTIFICATION APPLICATION NO. 192 OF

.....APPLICANT

....OPPONENTS

MARICO LIMITED

NARENDRASINGH KISHORSINGH

RAJPUROHIT TRADING AS M/S MANVAR PRODUCTS & ANR.

I.N. A R ENDRASINGH KISHORSINGH RAIPUROHIT TRADING AS M/S. MANVAR PRODUCTS 18/L/L, SATTADHAR COMPLEX, C.P. NAGAR CROSS ROAD, GHATLODIA, AHMEDABAD-380061, GUJARAT Take notice that the Applicant (s) abovenamed having presented R/RECTIFICATION APPLICATION NO. 192 OF 2022 (under section 57 of the Trade Mark Act, 1999), to this High Court praying for the rectification of Registration No. 2004603 in class 03 for the trade mark "MANVAR Label" in the name of Narendrasingh Kishorsingh Rajpurohit Trading As M/s. Manvar Products.
Whereas upon hearing and allowing the CIVIL APPLICATION NO. 10 F 2024 (For Substitute Service) in R/RECTIFICATION APPLICATION NO. 192 OF 2022 the Honourable Court (CORAM: ADDITIONAL REGISTRAR (UUDICIAL) on 25/06/2024 ordered to issue Notice to unserved Respondent No. 1 by way of publishing public notice in English and Gujarati language in local newspaper having wide circulation in the vicinity where the aforesaid unserved respondent no.1 was lastly known to have actually and voluntarily resided.

lastly known to have actually and voluntarily

lastly known to have actuany anu vountainy resided.

Take NOTICE that the hearing of the said R/RECTIFICATION APPLICATION NO. 199/2022 will take place on 06th August, 2024 at 11 AM peremptorily in this Court and if no appearance is made on your behalf, your advocate or by someone authorised by law to act for you it will be heard and determined in your absence.

Witness SUNITA AGARWAL, Esquire the CHIEF INSTICF at Ahmedabad aforesaid this 25th

JUSTICE at Ahmedabad aforesaid this 25th day of June, 2024. By the Court

(K.M.SUTARIYA) Assistant Registrar

units. Housing sales in Hyderabad stood at 1,300 units, up 44 per cent annually.Pune registered sales of 1,100 units, marking a 450 per cent year-on-year increase during this period, according to the report. "The luxury housing segment, particularly for properties priced at Rs 4 crore and above, is set to thrive as buyers seek homes that align with their affluent lifestyles," said Anshuman Magazine, Chairman and CEO
-- India, South-East Asia, the Middle East & amp; Africa at CBRE. Another

report earlier this month

revealed that the real es-

tate market witnessed

to the robust economy and growing demand for luxury lifestyles. The report from property consultant firm Knight Frank said housing sales above Rs 1 crore accounted for 41 per cent of total sales in H1 2024. This figure was 30 per cent in the same period in 2023. A total of 1,73,241 homes were sold in H1 2024, the highest sales figure in 11 years. This is an 8 per cent growth compared to the Rs 11,400 crore sales in the first half of 2023, according to the report by India Sotheby's 'International Realty and CRE

deposits. These large inflows

of foreign exchange also

help to prop up the rupee.

According to the RBI report,

the rupee has emerged as

the most stable among ma-

jtal foreign exchange

jumped to a lifetime

high of \$657.16 bil-

lion during the week

reserves

ended July 5.

segment saw sales worth Rs 8,752 crore, the secondbest half-yearly sales value in the past five years.

WESTERN RAILWAY- RATLAN

SUPPLY, INSTALLATION, AND COMMISSIONING OF CCTV CAMERA RECORDING-CUM-MONITORING SYSTEM Sr.DME/RTM, Western Railway, Ratlan vision invites IREPS Tender No. M442 CCTV-RTM-2024, Date of uploading o REPS: 17-07-2024 (Open tender, Single Packet system) for the following work. he date of opening happens to be a BANDH or Holiday, the tender will be pened at the same time on the followin vorking day. Name of the work with its location : Supply, installation, and commissioning of CCTV camera & cording-cum-Monitoring system fo ART/ARMV/140T CRANE siding at RTM JJN, COR. Approx. cost of work ₹11,50,230.67/- including all taxes and GST. **Earnest Money** : ₹23,000.00/completion period of work: 120 Days om the date of issue of LOA. Address of Office of the Sr. DME (C&W)/RTM, DRM Railway. Date & Time for submission and opening of tender : Closing Time 5:00 Hrs. on 12.08.2024. Opening Time 15:30 Hrs. on 12.08.2024. Website articulars & notice board location ender documents can also b wnloaded from website of IREPS**reps.gov.in** any other information equired by the tenderer can be obtaine om the office of Sr. DME/RTM, DRM OFFICE, Ratlam division, Western Railway during the working hours

Sr.DME(C&W) / RTM Like us on: f facebook.com/WesternRly

WESTERN RAILWAY- DAHOD BREAKING EXCITATION TRANSFORMER Sr.DvCMM/DHD. Western Railwa Dahod, Invites IREPS Tender No 61245535 closing Dt. 08/08/2024 for the following work. If the date of opening happens to be a BANDH or Holiday, the tender will be opened at the same time of the following working day. Name of work Breaking excitation transformer (ATFEX 60 KVA as per CLW specn. No CLW/ES/T 20 Alt.-H. Quantity: 12 Nos Approximate Cost of Work ₹31,71,840/- (Inclusive all taxes). Earnes Money: ₹158,592/-. Period of Contract 60 days. Time & Date for submission o E-Tender Document: Up to 11:00 Hrs or 08/08/2024. Time & Date for Opening o E-Tender: After closing date for filling o ender. Address of the office from where the tender opened: Office of the Dy.CMM Office, Western Railway, Dahod. Validity of Offer from Date of Opening: 90 Days Website particulars & notice board location: Tender documents can also be downloaded from IREPS website https://www.ireps.gov.in. Any othe information required by the tenderer car be obtained from the office o Sr.DyCMM/DHD during the working hours

Assistant Material Manager G-Western Railway, Dahoo Like us on: facebook.com/WesternRly

WESTERN RAILWAY- RATLAM

TRD WORK raction Distribution, Western Railway

Ratlam, invites e-tenders to the following 25/01RT. Date: 17/07/2024. Name of the work: TRD work in connection with various S&T at different location of Ratlam Division. Estimated cost of work : ₹1.41.93.759.50/-. Earnest Money Deposit / Bid Security ₹2,21,000/-. Completion period : 12 Month, Cost of tender document : Nil. Closing date and time: 12.08.2024 at 15:00 hrs. Validity of offer: 60 days from the date of opening. Website details www.ireps.gov.in. Notice board ocation: In front of the office of Sr. Divisional Electrical Engineer (Traction

COMPREHENSIVE ANNUAL MAINTENANCE CONTRACT 1. E-Tender Notice No. DRM-RJT-24

25-SnT-E-09 DT-12/07/2024; Address of the office: Divisional Railway Manage (S&T), Western Railway, Koth Compound, Rajkot - 360001; **Websit**e particular: www.ireps.gov.in; Tende 12/07/2024; Name of work: Rajko Division: MEDHA (Vani Road (VNRD) Bala Road (BLRD) Section), Renewal of Provision of Comprehensive Annual Maintenance Contract for Electronic Interlocking System (Medha Make) Model MEI633 at 08 Stations in the Van Road (VNRD) - Bala Road (BLRD Section of Raikot division for Three years Tender Cost: ₹ 2,18,58,341.76 (₹ Two Crore Eighteen Lakh Fifty Eigh Thousand Three Hundred Forty One Rupees and Seventy Six Paise only) Earnest Money Deposit: ₹ 2,59,300/- (₹ Two Lakh Fifty Nine Thousand Three Hundred only); Tender Form Fee: ₹ 00.00 (ZERO) As Per Para-3, GCC-Jul 22; Last Date & time for online appl

Sr.DEE/TRD/RTM on Date 12/08/2024 up to 15:30 hours. 59

Like us on: f facebook.com/WesternRly Like us on: f facebook.com/WesternRly ADARSH PLANT PROTECT LIMITED

Regd. Office: 604, GIDC, VITTHAL UDYOGNAGAR - 388 121, DIST. ANAND CIN No. L29210GJ1992PLC017845 Website: www.adarshplant.com Tel No. (02692) 236705 Fax No. (02692) 236704 Email ID : adarshplantprotect@gmail.com Extract of Audited Standalone Financial Results for the quarter ended 30th June, 2024 Quarter 30/06/2024 Year ended 31/03/2024 Particulars Un-audited Audited Total Income from Operations 48.60 Net Profit / (Loss) for the period before tax (after -16.80 7.67 48.60 et Profit / (Loss) for the period after tax (after otal Comprehensive Income for the period -16.80 7.67 48.60 quity share capital arning per share (Face Value of Rs.10/- each)

sults were reviewed and recommended by the Audit Committee and approved by

The above results were reviewed and recommended by the Audit Committee and approved he Board of Directors in their meeting held on 17th July, 2024.
 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements Regulations, 2015.
 The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange www.bseindia.com and on the website of the Company www.adarshplant.com
 Previous period's figures has been regrouped/ reclassified wherever required.

GUJARAT LEASE FINANCING LTD. (CIN: L65990GJ1983PLC006345)

Regd. Office: 6th Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridge Ahmedabad-380 006. Ph: 079-26575722, E-mail: glflho_ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

EXTRACT OF THE STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024

			(₹ in Lacs except per share data)	
Sl. No.	Particulars	Quarter ended	Year ended	Quarter ended
		30.06.2024	31.03.2024	30.06.2023
		(Un-audited)	(Audited)	(Un-audited)
1	Total Income	10.27	48.01	10.15
2	Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)
3	Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)
4	Total Comprehensive Income for the period (after tax)	(4.15)	11.56	(6.46)
5	Equity Share Capital	2712.58	2712.58	2712.58
6	Reserves excluding Revaluation Reserve as per Balance Sheet	-	(3128.05)	-
7	Earnings Per Share (of ₹ 10/- each)	(0.02)	0.03	(0.02)

Note: The above is an extract of the detailed financial results for the quarter ended June 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes, is available on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.gujaratleasefinancing.co.in.

Place: Ahmedabad Date: July 19, 2024

in 2022-23, after adjusting for inflation, compared to the corresponding figure recorded for 2011-12, acpromising monsoon, we cording to the survey.

શ્રી ભાગવત વિદ્યાપીઠ બી. એડ્. કોલેજ, સોલા અમદાવાદ ભરતી માટેની જાહેરાત ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત તેમજ યું.જી.સી. માન્યતા પ્રાપ્ત શ્રી

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળ સંલગ્ન (સ્વનિર્ભર) શ્રી

ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, સોલા, અમદાવાદ માટે સંસ્કૃત

માધ્યમમાં અધ્યાપન કરાવી શકે તેવા નીચે જણાવેલ જગ્યાઓ માટે

ભારતીય નાગરિકો પાસેથી આવેદનપત્ર આમંત્રિત કરવામાં આવે છે

જગ્યાનું નામ :- (૧) આચાર્ચ -૧ (૨) આસી. પ્રોફેસર જગ્યા-૧ (વિષય :- સંસ્કૃત વ્યાકરણ-૧)

સૂચનાઓ: (૧) નોકરી કરતા ઉમેદવારોએ સંસ્થાના વડા મારફત અરજે. મોકલવી. (૨) ઉમેદવારે પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થચેથી દિન- ૨૧માં સંપૂર્ણ વિગતો સાથે ૨જી.એ.ડી.થી, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, શ્રી ભાગવત વિદ્યાપીઠ, કૃષ્ણ ધામ, એસ.જી. હાઇવે, મુ. સોલા, અમદાવાદ ને મોકલવાની રહેશે, સમય મર્યાદા બાદ આવેલ અરજી અમાન્ય રહેશે. (૩) અરજી કરવા માટેનું નિયત નમુનાનું ફોર્મ તથા જરૂરી સુચના www.sbvtbedcollege.org વેબસાઈટ પરથી મળશે. (૪) નિમણૂંક પામના૨ ઉમેદવા૨ને યુ.જી.સી./ સ૨કા૨શ્રી/ યુનિવર્સિટી તેમજ સંસ્થાના વખતોવખતના બધા નિયમો બંધનકર્તા

કા. આચાર્ચ શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એફ. કોલેજ મું .સોલા, અમદાવાદ

Form No. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Act. [Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application has been made to the Registrar at Gujarat that M/S SHREEJI AGRI IMPEX, a partnership firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013 as a company limited by shares.

2. The principal objects of the company are as follows: -

1. To carry on the business to manufacture, produce, plant, grow cultivate, re-fill, import, export, buy, sell, process, prepare, crush and otherwise dealing in edible and non-edible oils, oilseeds, brans, casto and oil cakes of any nature and kind whatsoever, including linters, hulls expeller oil cakes, de-oiled cakes, hardened oils, Vanaspati ghee, margarine, edible proteins, castor oil, alkali refined linseed oil, industrial oils, extraction of linseed, cotton seed, groundnut oil, fertilizer mixtures, hydrogenated castor oil, oil and pharmaceutical, groundnut cakes, my rabolum and nuts seeds oil and mineral oils.

2. To carry on the business of manufacture, trade, import, export, buy sell, preservers, segregate, pack, repack, transport, store, forward distribute, develop, handle, prepare, crush, grind, mix, polish, sortex clean, improve, process and deal in all kinds, varieties, forms, descriptions of beans, dals, lentils, pulses, grains, salts, Cereals Jaggery, dry fruits, products from milk and other- dairy products, and spices including but not limited to wheat, rice, chana, toor dals, millets groundnut kernels, groundnut inshells, peanut butter, sabudana, carom seed, Sesame seeds (black and yellow), coriander seed, saffron, fenugreek, cardamom, fennel seeds, cinnamon powder, mustard seeds, chilies, chilli powder, pepper, cloves, cumin, cumin powder, coriander coriander powder, turmeric, turmeric powder, pickles, asafoetida, dried ginger powder, dried mango powder, Saunf, cow ghee, buffalo ghee, mill powder, sugar, other products derived from milk, all types of garam masala, different types of other masalas, herbs, seasonings, almonds, cashews, raisins, pistachios, apricots, dried fig, walnut, cranberries dates, Makhana (foxnut) and all other grocery products and agri related

3. To carry on the business in India or elsewhere as buyers, sellers merchant, exporter, importer, traders, agents, dealers, distributors commission agents, brokers, stockiest, preservers, factors, consignors collaborators, franchisers, concessionaire, consultants, advisors manufacturers, manufacturers representative, job worker, assembler repairers, facilitators, hirer, leaseholder, clearing and shipping facilitators custom house facilitators, whar fingers, charters hirers, superintendents representative, facilitators & service providers for liaising and clearing service for and otherwise deal in all kinds, classes, size nature and description of industrial, commercial, consumer capital goods, item things, articles, commodities, merchandise, products and allied activities.

3. A copy of the draft memorandum & articles of association of the proposed company may be inspected at the office at 1 2, 169, Shakl

Mandlikpur Road, Juni Shankali, Village, Jetpur, Rajkot-360370.

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Centra Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA). Plot No. 6,7,8, Sector 5, IMT, Manesar, District Gurgaon(Haryana), PIN Code- 122050, within twenty one days from the date of publication of this notice, with a copy at its registered office. Dated this 20 th Day of July, 2024

Name(s) of Applicant (1) Jagdish Padariya (2) Nikunj Padariya (3) Ghanashyam Patoliya (4) Devraj Hirapara (5) Anjanaben Gondaliya (6) Dharmishthaben Padariya(7) Kinjalben Padariya

Forex inflows from NRIs surge 4fold to \$2.7 bn in April-May Mumbai, The money rom Indians working overseas that come into NRI de Mark that the state of the state o

Mumbai, The money from Indians working overseas that come into NRI deposits of banks surged more than 4-fold to \$2.7 billion in April-May this year compared to \$0.6 billion in the same period last year, strengthening the country's foreign exchange reserves, the latest data compiled by the RBI showed. The total NRI de-

posits as of May have now gone up to \$154.72 billion.

WESTERN RAILWAY- DAHOD

SET OF AIR STRAINER TYPE-T Sr.DyCMM/DHD, Western Railwa Dahod, Invites IREPS Tender No 61246007 closing Dt. 03/08/2024 for the following work. If the date of opening nappens to be a BANDH or Holiday, the ender will be opened at the same time or he following working day. Name of work Set of air strainer type-T as per CLW Drg No. 0/2/65/440 Alt-0, conforming to spec No. CLW/TS/99-90/0014. Set consist of 3 items 20 Nos as follows: (i) 1/2" BSP = 1: Nos (ii) 3/8" BSP = 05 Nos. Quantity: 8 Set. Approximate Cost of Work ₹40.12.000/- (Inclusive all taxes). Earnes Money: ₹2,00,600/-. Period of Contract 60 days. Time & Date for submission of E-Tender Document: Up to 11:00 Hrs of 03/08/2024. Time & Date for Opening o E-Tender: After closing date for filling of ender, Address of the office from whe the tender opened : Office of the Dy.CMM Office, Western Railway, Dahod. Validity of Offer from Date of Opening: 90 Days Website particulars & notice board location: Tender documents can also be downloaded from IREPS website https://www.ireps.gov.in. Any othe information required by the tenderer car be obtained from the office o Sr.DyCMM/DHD during the working hours

Assistant Material Manager G-SNP-151 Western Railway, Daho Like us on: f facebook.com/WesternRly

ADARSH PLANT PROTECT LIMITED CIN No : L29210GJ1992PLC017845

Regd. Office: 604, GIDC Estate, V. U. Nagar – 388 121, Anand, Gujarat. Tel No.: (02692) 236705, Fax No.: (02692) 236704 $Website: \underline{www.adarshplant.com} \quad Email: adarshplantprotect@gmail.com$ NOTICE TO THE MEMBERS FOR 32nd ANNUAL GENERAL MEETING OF ADARSH PLANT PROTECT LIMITED (Company) TO BE HELD AT THE REGISTERED OFFICE 604, GIDC

ESTATE, V.U. NAGAR-388 121, ANAND. 1. Notice is hereby by given that the 32nd Annual General Meeting ('AGM') of the Company will be held physically on Saturday, the 14nd day of September, 2024 at 11.00 A. M. (IST).

2. Pursuant to the above circulars, the Notice of the 32nd AGM, Standalone Financial Statements for the financial year 2023-24, along with Board's Report, Independent Auditors' Report and other documents required to be attached thereto, will be sent to the members whose email address are registered with the Company/Depository Participant(s). The aforesaid documents will also be available at ourpany's website i.e. www.besindia.com and on the Bombay stock exchange's website where Company's securities are listed i.e. www.besindia.com

website i.e. www.bscindia.com and on the Bombay stock exchange's website where Company's securities are listed i.e. www.bscindia.com 3. The manner of casting vote through electronic mode:
a.a. The Company is pleased to provide members the facility to exercise their right to vote on resolutions proposed to be considered at the 32 on Annual General Meeting by electronic means and the business may be transacted through e-Voting Services.
www.adarshplant.com ball commence on Wednesday, 11 on September, 2024 at 09:00 a.m. (IST) and shall end on Friday, 13 on September, 2024 at 05:00 p.m. (IST).
c. Detailed instructions for e-voting given in the notice of the AGM which will be available at Company's website (www.bscindia.com).
d.) The Company has engaged the services of NSDL as authorized e-voting agency and has made relevant arrangements with them for facilitating voting through electronic means. Hence notice of the AGM and e-voting instructions will be available at NSDL's website as well. (https://www.evoting.nsdl.com/)
<a href="https

4. The manner to get registered/updated email address:
a.) Kindly click/copy this link https://linkintime.co.in/EmailReg/Email Register.html and select your Company's name fill the mandatory details and update email Id and bank details in the given field, OR
b.) Shares held in Demat mode: The shareholder can contact the Depository Participant ("DP") and register the email address and bank account details in the demat account as per the process followed and advised by the DP or by clicking above given link to update their details
5. The Register of Members and Share Transfer Book of the Company will remain closed from Sunday, 8th September, 2024 (both days inclusive) for the purpose of AGM.
Cut-off date for the purpose of AGM is Saturday, 7th September, 2022.
6. The members are advised to go through all the notes carefully given in AGM notice for attending AGM and to cast their vote electronically. 4. The manner to get registered/updated email address:

For & on behalf of Adarsh Plant Protect Limited Managing Director

દાહોદ એલસીબીએ આસાયડી હોટલ અને કેસરપુર ઘાટી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો



(પ્રતિનિધિ) દાહોદ,

મધ્યપ્રદેશના પેટલાવદ ગામે વિદેશી દારૂના ઠેકા પરથી સડેલી કાકડી તેમજ દૂધીના પોટલાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વડોદરા પહોંચાડવા જઈ રહેલા બે ટેમ્પા ઇન્દોરથી ગોધરા તરફ જતા હાઈવે પર આસાયડી હોટલ આગળ દાહોદ એલસીબી પોલીસે પકડી પાડી બંને ટેમ્પાની અંદર કાકડી તેમજ દૂધીના પોટલાની આડમાં સંતાડેલ રૂપિયા ૧૬ લાખ ઉપરાંતની કિંમતનો વિર્દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેમ્પો તથા બે મોબાઈલ ફોન મળી રૂપિયા ૧૯,૧૭,૦૪૦/-ના મુદ્દા માલ સાથે બંને ટેમ્પાના ચાલકોની અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું

મધ્યપ્રદેશના પેટલાવદથી વિદેશી

અશોક લેલેન્ડના બે અલગ અલગ ટેમ્પોમાં દુધી તેમજ કાકડી જેવા શાકભાજીના પોટલાઓની પાછળ સંતાડીને વડોદરા ગોલ્ડન ચોકડી પર રાજુ નામના ઇસમને આપવા જઈ રહ્યા હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પીએસઆઇ એમ.એલ ડામોર તથા તેમના સ્ટાફની ટીમ ઇન્દોર-ગોધરા હાઇવે પર અસાયડી હોટલ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અસાઇડી હોટલથી થોડે દૂર એમપી.૧૧.જી-૪૦૩૮ તથા એમપીં૧ ૩જીબી -૦૨૪૬ એમ અશોક લેલેન્ડના બે ટેમ્પા ઉભા હતા. જેથી પોલીસે બંને ટેંપાને પકડી પાડી બંને ટેમ્પાના ચાલક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજોડ ગામના મનોજ ઉર્ફે કાલુ મનસુખલાલ વર્મા તથા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગુંદીખેડા

દારૂનો જંગી જથ્થો એમપી પાસિંગના ગામના શંભુ ઉર્ફે બંટી રમેશભાઈ ચંડાલની અટકાયત કરી પોલીસે બંને ટેમ્પામાં કાકડી તથા દૂધી જેવા શાકભાજીના પોટલાની હોડમાં લઈ જવાતા ભારતીય બનાવટના રૂપિયા ૧૬,૦૭,૦૪૦/-કુલ કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૪૮ માં ભરેલ બોટલ નંગ-૧૧૯૦૪ પકડી પાડી પકડાયેલ બંને ટેમ્પાના ચાલક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન તથા દુધી તેમજ કાકડીના પોટલા વગેરે પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેંમ્પા મળી કુલ રૂપિયા ૧૯,૧૭,૦૪૦/

-નો મુદ્દામાલ કંબજે લીધો હતો. દાહોદ એલસીબી પોલીસે કેસરપુર ઘાટી ગામેથી રૂ. ૨.૩૩ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ખોટી નંબર પ્લેટ વાળી hvundai કંપનીની ક્રેટા ગાડી પકડી પાડી કબજે લીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર જીજે ૨૭બી.એસ.૦૬૮૪ નંબરની hyundai કંપનીની ક્રેટા ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદથી લીમખેડા તરફ આવતી હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમે ગતરોજ સવારે સાડા દસ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સિંગવડ તાલુકાના કેસરપુર ઘાટી ગામ નજીક રોડ પર જરૂરી વોંચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી હોન્ડાઈ કંપનીની creta ગાડી ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ક્રેટા ગાડીના ચાલકે ગાડી ભગાવી મુકતા પોલીસે creta ગાડીનો

પીછો કરી ગાડીને ઓવરટેક કરી ગાડી ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે થોડે દૂર જઈ ગાડી રસ્તાની સાઈડમાં ઉભી રાખી ગાડીનો દરવાજો ખોલી ચાલક ગાડીમાંથી ઉતરી કેસરપુર ઘાટીના જંગલના ઝાડી ઝાંખરામાં થઈ નાસી ગયો હતો. જે ક્રેટા ગાડી પોલીસે પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૨,૩૩,૦૩૩/-ની કુલ કિંમતની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૯૯ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૦ લાખની કિંમતની હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી મળી કુલ રૂપિયા ૧૨,૩૩,૦૩૦/-નો મુદ્દા માલ કબજે લઈ ગાડીની નંબર પ્લેટ ચકાસતા ગાડીની નંબર પ્લેટ પણ ખોટી હોઇ તેનો સાચી નંબર પ્લેટ તરીકે ઉપયોગ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આ સંબંધે ક્રેટા ગાડીના નાસી ગર્યેલા ચાલક વિરુદ્ધ રંધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આમ આમ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો

જેતપુરમાં દારૂના ગુનામાં પાંચ મહિનાથી ફરાર આરોપી ઝબ્બે

ગતિમાન કર્યા છે.

જેતપુરઃ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીંશનના ગુનામા પાંચ મહીનાથી ફરાર આરોપી ચીરાગ ઉર્ફે કાળુ કેશુ બોરડા હાલ રહે. સુરત, મુળ ગારીયાધારના વદરને પોલીસે પકડી પાડયો હતો. આરોપી સુરત અને સાવરકુંડલામાં પણ ગુના આચરી ચુકયો હતો.

ફરતો આરોપી ઝડપાયો (પ્રતિનિધિ) નડિયાદ, ૧૧૨૦૪૦૧૭૨૨૦૧૦૮/૨૦૨૨ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાર્દ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના કામનો નાસતો ફરતો આરોપી જીતુભાઇ

ચોરીના ગુનામાં નાસતો

નાઓએ ખેડા નડીયાદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીએને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ઉત્તરસંડા તા.નડીયાદ જી.ખેડા નાનો સ્પેશીયલ ડ્રાઇવ આપેલ

હોય ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ આગામી સમયમાં ગુરુ પુર્ણીમાં આવતી હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા

આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.દેસાઇ નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી નાસતા ફરતા આરોપીઓને પકડી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ દરમ્યાને વડેતાલ પોલીસ સ્ટેશનના માણસો સાથે વડતાલ પો.સ્ટે.

સ્ટેશનના



તપાસમાં



નાનીગોરોશરૂથઈહતી.આજથીમોટીગોરોશરૂથઈછે.મનગમતાપતિ નવા મારવાડામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરે પુજારી રમેશભાઈ (તસ્વીર:-હસંમુખ પંચાલ,ખેડબ્રહ્મા)

અમદાવાદીઓને પેટ પકડીને હસાવતું નાટક એટલે વિદેશી વહુ તને શું કહું

અમદાવાદીઓને ખરેખર ઘેલું

વહુ, તને શું કહું" નો અત્યંત ટૂંકા દિગ્દર્શિત આ નાટક વિદેશી વહુ તને ગાળામાં જ લગાવે તેવું નાટક એટલે ''વિદેશી

દ્દરમો રેકોર્ડ બ્રેશ શહે રના ઠાકો રભાઈ દેસાઈ હોલમાં યોજાયો હતો હાસ્યની નોન સ્ટોપ ધમાચકડી જેવા આ નાટ્ય શોના એક એક કલાકારો ભારે

દાદ માંગી લે તેવા કાબિલે દાદ અભિનયના અજવાળા પાથરનારા સાબિત થાય તેમ છે. સિંહણ જેવી કાઠીયાવાડી સાસુને પડકારતી અમેરિકન વહુ ભારે તોફાની હોવાની સાથે સાથે બિલકુલ સહજરીતે અર્થના જે પ્રકારે અનર્થ કરે છે તે પ્રેક્ષકોમાં ભારે હાસ્યની છોળો ઉડાડે છે.

જાણીતા નિર્માણકાર વિવેક શાહ પ્રસ્તુત તેમજ ચિન્મય પંડ્યા (અધિકારી) અને બકુલ પરમાર ઇશ્વરભાઇ પરમાર રહે. પુનમપુરા તાબે હાલ ઉત્તરસંડા ચોકડી આવનાર છે

અને તેણે શરીરે આછા ગુલાબી તેમાં મરુન તથા વાદળી પટ્ટા વાળી ટીશર્ટ તથા ગ્રે કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. જે બાતમી હકિકત આધારે સુંદર ઇસમની વોચ રહી

ઉપરોકત બાતમી હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ બાતમીના વર્શન મુજબના કપડા પેહેરેલ ઉભો હતો જેની ઉપર શક જતા તેને સ્થળ ઉપર રોકી લઇ પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને સદર ઇસમને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે, પોતે ચકલાસી પોલીસ સ્ટેશનના ગુ.રજી.નં. 112080 19220106/2022 ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુનાનો નાસતો-ફરતો હોવાનુ જણાવતો હોય વિસ્તારમાં પેટ્રાંલીંગમાં હતા દરમ્યાન નાસતા-ફરતા હાવાનુ જણાવતા હાય અ.પો.કો. વિષ્ણુભાઇ તથા જેથી તેને ઉપરોક્ત ગુનાના કામે પકડી આકાશકુમાર નાઓને સંયુક્ત બાતમી BNSS કલમ ૩૫ (જે) મુજબ અટક હિકિકત મળેલ કે, ચકલાસી પોલીસ કરી ચકલાસી પોલીસ સ્ટેશન વધુ ગુ.૨જી.નં. કાર્યવાહી માટે સોંપેલ છે.



ખેડબ્રહ્માપંથકમાંગામેગામગૌરીવ્રતનોપ્રારંભથયોછે.બેદિવસપહેલા અનેસુખાકારીમાટેબાળાઓદ્વારાઆવ્રતકરાયછે.ખેડબ્રહ્માશહેરના શંકરભાઈ વ્યાસ દ્વારા સમૂહમાં બાળાઓને પૂજા કરોવાઈ હતી .

> અમદાવાદ, ધ્વારા સહપ્રસ્તુત ઋષિકેશ ઠકકર અને સંદીપ વ્યાસ ધ્વારા લિખિત અને નીશીથ કુમાર બ્રહ્મભટ્ટ ધ્વારા

> > કલાક સુધી સતત પ્રેક્ષકોને જકડી રાખે છે. 3 c 5 6 5 કલાકારો**ં** માં

પોતાના પાત્રોને સુપેરે રજૂ કરે કરનાર ચાર્મી કેલૈયા, પ્રશાંત સુખડીયા,

કરિશ્મા પાટડીયા, સત્યમ જોશી, કેતન ચૌધરી અને પૃથ્વી પાટીલે પોતાની જન રેડીને અભિનયના ઓજસ પાથર્યા છે. માનવી માનવી વચ્ચેની લાગણી અને સાસુ ખતરામાં આવતા જ વહુ પોતાનાથી બનતું બધું જ કરી છુટીને કેવી રીતે આવનારા એધાણને ઓળખીને પોતાની સાસુ માટે ઢાળ બનીને ઉભી રહે છે અને પોતાના પરિવારના અસ્તિત્વ ઉપર આવનારી આફતને સિફતપૂર્વક ટાળે છે તે જ દર્શાવે છે કે, પરિવાર છે તો બધું જ છે.

🐧 પશ્ચિમ રેલ્વે-દાહોદ ટી-ટાઇપનો એર સ્ટ્રેનર સેટ Sr.DyCMM/DHD, પશ્ચિમ રેલ્વે, દાહોદ, IREPS 2-32 -142 89288000 આમંત્રિત કરે છે, તા. નીચેના કામ માટે ૦૩/ ૦૮/૨૦૨૪. જો ખોલવાની તારીખ બંધ અથવા રજા હોય, તો ટેન્ડર તે જ સમયે તે પછીના કામકાજના દિવસે ખોલવામાં આવશે. **કામનું ын:** CLW Drg મુજબ એર સ્ટ્રેનર પ્રકાર-Tનો સેટ. નંબર **0/2/65/440** Al**t-0**, સ્પેકને અનુરૂપ. નંબર CLW/TS/99-90/ 0014. સમૂહ-૨નો સમાવેશ કરે છે આઇટમ ૨૦ નંગ નીર્ચે મુજબ છેઃ (i) 1/2" BSP = ૧૫ નંગ (ii) 3/8" BSP – ૦૫ નંગ. જથ્થોઃ ૮૦ સેટ. કામની અંદાજિત કિંમતઃ ૪૦,૧૨,૦૦૦/- (બધા કર સહિત). **અર્નેસ્ટ** मनीः २,००,६००/-. <mark>કરારની અવધ</mark>િः ६० દિવસ. ઇ-ટેન્ડર દસ્તાવેજ સબમિટ કરવાનો <mark>સમચ અને તારીખઃ</mark> ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાક સુધી.ઇ-ટેન્ડર ખોલવાનો સમય અને તારીખઃ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ પછી. ઓફિસનું સરનામું જ્યાંથી ટેન્ડર ખોલવામાં આવ્યું છે: Sr.DyCMMની ઓફિસ, પશ્ચિમ રેલવે, દાહોદ. શરૂઆતની તારીખથી ઓફરની માન્યતાઃ ૯૦ દિવસ. વેબસાઇટ વિગતો અને નોટિસ બોર્ડ સ્થાન ક્રેન્ડર દસ્તાવેજો પણ હોઈ શકે છે. IREPS વેબસાઇટ https://www.ireps.gov.in પરથી ડાઉનલોડ કરો. ટેન્ડરર દ્વારા જરૂરી અન્ય કોઈપણ માહિતી કામકાજના કલાકો દરમિયાન Sr.DyCMM/DHDની ઓફિસમાંથી

મુખ્ય વર્કશોપ મેનેજર જી-૧ ક કરો : **f** facebook.com/WesternRly

🕼 પશ્ચિમ રેલ્વે-દાહોદ

બ્રેકિંગ એક્સિટેશન ટ્રાન્સફોર્મર Sr.DyCMM/DHD, પશ્ચિમ રેલ્વે, દાહોદ, IREPS ટેન્ડર નંબર કવર૪૫૫૩૫ બંધ તા નીચેના કામ માટે ૦૮/૦૮/૨૦૨૪ આમંત્રિત કરે છે. . જો ખોલવાની તારીખ બંધ અથવા રજા હોય, તો ટેન્ડર તે જ સમયે તે પછીના કામકાજના દિવસે ખોલવામાં આવશે. **કામનું નામઃ** CLW સ્પેકન મુજબ બ્રેકિંગ એક્સિટેશન ટ્રાન્સફોર્મર (ATFEX) ૬૦ KVA. કોઈ CLW/ES/T ૨૦ Alt.-H. જથ્થોઃ ૧૨ નંગ કામની અંદાજિત કિંમતઃ ૩૧,૭૧,૮૪૦/- (બધા કર સહિત). અ**ર્નેસ્ટ મનીઃ** ૧૫૮,૫૯૨/-. કરારની અવધિઃ हुए हिवस, ध-डेन्डर हस्तावेष सलमिड **કરવાનો સમય અને તારીખ:** OZ/OZ/२०२४ ના રોજ ૧૧:૦૦ કલાક સુધી. ઇ-ટેન્ડર ખોલવાનો સમય અને તારીખઃ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ પછી. ઓફિસનું સરનામું જ્યાંથી ટેન્ડર ખોલવામાં આવ્યું છેઃ Dy.CMMની ઓફિસ. પશ્ચિમ રેલવે. દાહોદ. શરૂઆતની તારીખથી ઓફરની માન્યતાઃ ૯૦ દિવસ વેબસાઇટ વિગતો અને નોટિસ બોર્ડ સ્થાન ટેન્ડર દસ્તાવેજો પણ હોઈ શકે છે. IREPS વેબસાઇટ https://www.ireps.gov.in પરથી ડાઉનલોડ કરો. ટેન્ડરર દ્વારા જરૂરી અન્ય કોઈપણ માહિતી કામકાજના કલાકો દરમિયાન Sr.DyCMM/DHDની ઓફિસમાંથી મેળવી શકાય છે.

SNP-152

ફોર્મ નંબર ચુઆરસી-૨

અધિનિયમના XXI પ્રકરણના ભાગ I હેઠળ નોંધણી વિશે સૂચના આપતી જાહેરાત. [કંપની અધિનિયમ, 2013 નીકલમ 374(b) અને કંપનીઓના નિયમ 4(1)ને અનુસરીને (નોંધણી માટે અધિકૃત) નિયમો, 2014]

<mark>૧.</mark> આથી સૂચના આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૩૬૬ ની પેટા-કલમ (૨) ના અનસંધાનમાં, ગજરાત ખાતેના રજિસ્ટારને અરજી કરવામાં આવી છે કે M/S શ્રીજી એગ્રી ઇમ્પેક્સ, ભાગીદારી પેઢી રજીસ્ટર થઈ શેકે છે. કંપની એક્ટ ૨૦૧૩ ના પ્રકરણ XXI નાભાગ I હેઠળ, શેર દ્વારા મર્યાદિત કંપની તરીકે.

<mark>૨. કંપનીના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે</mark> :-

(૧) ખાદ્ય અને અખાદ્ય તેલ, તેલીબિયાં, બ્રાન્સના ઉત્પાદન, ઉત્પાદન, વાવેતર, વૃદ્ધિ, ખેતી, પુનઃ ભરવા, આયાત, નિકાસ, ખરીદી, વેચાણ, પ્રક્રિયા, તૈયાર, ક્રશ અને અન્યથા વેપાર કરવા માટેનો વ્યવસાય ચાલુ રાખવા માટે, એરંડા અને તેલની કોઈપણ પ્રકારની અને કોઈપણ પ્રકારની કેક, જેમાં લીંટર, હલએક્સપેલર ઓઈલ કેક, ડી-ઓઈલ્ડ કેક, કઠણ તેલ, વનસ્પતિ ઘી, માર્જિન, ખાદ્ય પ્રોટીન, એરંડાનું તેલ, આલ્કલી રિફાઈન્ડ અળસીનું તેલ, ઔદ્યોગિક તેલ, અળસીનું નિષ્કર્ષણ, કપાસના બીજ, મગફળીનું તેલ, ખાતર મિશ્રણ, હાઇડ્રોજન યુક્ત એરંડા તેલ, તેલ અને ફાર્માસ્યુટિકલ, સીંગ દાણાની કેક, માયરાબોલમ અને બદામના બીજનું તેલ અને ખનિજ તેલ.

(૨) ઉત્પાદન, વેપાર, આયાત, નિકાસ, ખરીદો, વેચાણ, પ્રિઝર્વર્સ, અલગ, પેક, રીપેક, પરિવહન, સ્ટોર, ફોરવર્ડ, વિતરણ, વિકાસ, હેન્ડલ, તૈયાર, ક્રશ, ગ્રાઇન્ડ, મિશ્રણ, પોલિશ તમામ પ્રકારના, જાતો, સ્વરૂપો, કઠોળ, દાળ, દાળ, કઠોળ, અનાજ, ક્ષાર, અનાજ, ગોળ, સૂકા ફળો, દૂધમાંથી ઉત્પાદનો અને અન્ય ડેરી ઉત્પાદનો અને મસાલાઓ સહિત તમામ પ્રકારના સોર્ટેક્સ, સ્વચ્છ, સુધારણા, પ્રક્રિયા અને વ્યવહાર કરો. પરંતુ ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, બાજરી, મગફળીના દાણા, પીનટ બટર, સાબુદાણા, કેરમસીડ, તલ (કાળા અને પીળા) સુધી મર્યાદિત નથી. ધાણા, કેસર, મેથી, એલચી, વરિયાળી, તજ પાવડર, સરસવના દાણા, મરચાં, મરચાંનો પાવડર, મરી, લવિંગ, જીરું, જીરું પાવડર, ધાણા, ધાણા પાવડર, હળદર, હળદર પાવડર, અથાણું, હિંગ, સૂકા આદુનો પાવડર, સૂકા કેરીનો પાવડર, સોનફ, ગાયનુંઘી, ભેંસનુંઘી, દૂધનો પાવડર, ખાંડ, દૂધમાંથી મેળવેલા અન્ય ઉત્પાદનો, તમામ પ્રકારના ગરમ મસાલા, વિવિધ પ્રકારના અન્ય મસાલા, જડીબુટ્ટીઓ, સીઝનીંગ, બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા, જરદાળુ, સૂકા અંજીર, અખરોટ, ક્રેનબેરી, ખજૂર, મખાના (ફોક્સનટ⁾ અને અન્ય તમામ કરિયાણા ઉત્પાદનો અને કૃષિ સંબંધિત ઉત્પાદનો.

બેજન્ટો, ડીલરો, વિતરકો, કમિશન એજન્ટો, દલાલો, સ્ટોકીસ્ટ, પ્રિઝર્વર્સ, ફેક્ટર્સ, કન્સાઇનર્સ, સહયોગીઓ, ફ્રેન્ચાઇઝર્સ, કન્સેશનર, કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય ચાલુ રાખવા માટે , સલાહકારો, ઉત્પાદકો, ઉત્પાદકોના પ્રતિનિધિ, જોબવર્કર, એસેમ્બલર, રિપેરર્સ, ફેસિલિટેટર, ભાડે લેનાર, લીઝ ધારક, ક્લીયરિંગ અને શિપિંગ ફેસિલિટેટર, કસ્ટમ હાઉસ ફેસિલિટેટર્સ, વ્હાર્ફિંગર્સ, ચાર્ટર્સ ભાડે રાખનારા, સુપરિન્ટેન્ડન્ટ્સ, પ્રતિનિધિ, ફેસિલિટેટર બને સર્વિસ પ્રોવાઈડર્સ અને ક્લિયરિંગ સર્વિસ માટે અન્યથા તમામ પ્રકારના, વર્ગો, કદન<u>ી</u> પ્રકૃતિ અને ઔદ્યોગિક, વ્યાપારી, ઉપભોક્તા કેપિટલ ગુડ્સ, વસ્તુઓ, વસ્તુઓ, લેખો, કોમોડિટીઝ, મર્ચેન્ડાઇઝ, ઉત્પાદનો અને સંલગ્ન પ્રવૃત્તિઓના વર્શનમાં વ્યવહાર કરો.

<mark>૪.</mark> આથી સૂચના આપવામાં આવે છે કે આ અરજી સામે વાંધો ઉઠાવનાર કોઈપણ વ્યક્તિ પોતાનો વાંધો સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (CRC) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (IICA), પ્લોટ નંબર ૬,૭,૮, સેક્ટર પ ખાતેના રજિસ્ટ્રારને લેખિતમાં જણાવી શકે છે., IMT, માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિયાણા), પિનકોડ- ૧૨૨૦૫૦, આ નોટિસના પ્રકાશનની તારીખથી એકવીસ દિવસની અંદર, તેની નોંધાયેલ ઓફિસમાં એક નકલ સાથે. તા. ૨૦જુલાઈ, ૨૦૨૪ ના દિવસે

અરજદારનું નામ : (૧) જગદીશ પાદરીયા (૨) નિકુંજ પાદરીયા (૩) ઘનશ્યામ પટોળીયા (૪) દેવરાંજ હીરાપરા (૫) અંજનાબેન ગોંડલીયા (૬) ધર્મિષ્ઠાબેન પાદરીયા (૭) કિંજલબેન પાદરીયા

કોંગ્રેસે બજેટ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારી કરી, રાહુલ ગાંધીએ એક્શન પ્લાન બનાવ્યો

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન

બજેટ સંત્રમાં સરકારને ઘેરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીનું ફોકસ યુવાનો, ખેડૂતો-મજૂરો, સૈનિકોની સાથે સામાન્ય લોકો એને ગરીબો પર રહેશે. ૨૨ જુલાઈથી શરૂ થઈ રહેલા બજેટ સંત્ર પહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત સામાન્ય ગરીબ લોકો, વધતી જતી મોંઘવારી અને ઘટતી કમાણી, યુવા બેરોજગારી

ખેડબ્રહ્મા તાલુકા બાર ગોળ ઠાકોર સમાજના નવા વરાચેલા પ્રમુખનો વિરોધ (પ્રતિનિધિ) ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મા તાલુકા તથા આસપાસના ગામોમાં રહેતા ઠાકોર સમાજની એક મીટીંગ તારીખ ૧૯ 🕼 જલાઈ ૨૦૨૪ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી મંદિરમાં મળી હતી. આ મિટિંગમાં નવા પ્રમુખ પદે ચૌહાણ અર્જીનભાઈ સોમાભાઈની વર્શી કરાઈ હતી. ત્યારે સમાજના અમુક લોકોએ નવા પ્રમુખ નો વિરોધ કર્યો હતો અને વિરોધ કરનાર લોકો ના મતે નવા પ્રમુખે સમાજના અમુક લોકોને ગેરમાર્ગે દોરી, પૈસા ખવડાવી, બહાર ફરવા લઈ જઈ રાજકારણ રમી સમાજના પ્રમુખ બની બેઠા છે. આવા પૈસા ખવડાવી પ્રમુખ બનનાર સમાજનું ભલું ન કરી શકે માટે નવેસરથી સમાજની ફરી મિટિંગ બોલાવી સમાજના આગેવાનો વડીલો અને યુવાનોની હાજરીમાં સમસ્ત બારગોળ સમાજના પ્રમુખની વરણી કરવી જોઈએ તેવી સંભાવના પ્રમુખને ઉદ્દેશી અરજી

अने स्वाभिनाथन समितिनी केवा मुद्दा ઉઠाववानी तैयारी

લેસ્ટર્ને ટાઇક્સ

જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

પશ્ચિમ રેલ્વે-રતલામ

ટીઆરડી વર્સ સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન, વેસ્ટર્ન રેલવે, રતલામ નીચેના કામ માટે ઈ-ટેન્ડર આમંત્રિત કરે છે ટેન્ડર નંબર : EL/TRD/58/2024-25/01RT. તારીખઃ ૧૭/૦૭/૨૦૨૪. કામનું નામઃ વિવિધ એસએન્ડટી સાથે જોડાણમાં ટીઓરડી કાર્ય રતલામ વિભાગ. કામની <mark>અંદાજિત કિંમતઃ ૧,૪૧,</mark>૯૩,૭૫૯.૫૦/-. બાનું નાણાં જમા બિડ સુરક્ષા : રૂા.૨,૨૧,૦૦૦/-. સમાપ્તિ અવધિઃ ૧૨ . માસ. **ટેન્ડર દસ્તાવેજની ક્લિંમતઃ** શૂન્ય. સમાપ્તિ તારીખ અને સમય ૧૨.૦૮.૨૦૨૪ **૧૫:૦૦ કલાકે.** ઓફરની માન્યતાઃ ખોલવાની તારીખથી ૬૦ દિવસ. **વેબસાઇટ વિગતો**: www.ireps.gov.in. નોટિસ બોર્ડનું સ્થાનઃ સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન), વેસ્ટર્ન રેલવે, રતલામ - ૪૫૭૦૦૧ની ઑફિસની

કરવામાં આવી રહી છે.

તેમજ વિપક્ષ આ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવીને સરકારને અલગ કરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ લોકસભામાં સત્ર દરમિયાન કામદારોનું લઘુત્તમ વેતન વધારીને ૪૦૦ રૂપિયા કરવાની માંગ કરશે. સાથે જે કોંગ્રેસ સૈનિકો માટેની અગ્નિવીર યોજના બંધ કરવાની

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

Sr.DEE/TRD/RTM લાઇક કરો : **f** facebook.com/We<u>stern</u>

પશ્ચિમ રેલવે-રાજકોટ ડિવિઝન

<u>વ્યાપક વાર્ષિક જાળવણી કરાર</u> 1. <u>ઈ-ટેન્ડર નોટિસ નં.</u>: DRM-RJT-24-25-SnT-E-09 તા. 12/07/2024; ઓફિસન્ <u>સરનામું</u>: ડિવિઝનલ રેલવે મેનેજર (એસ એન્ડ ટી), પશ્ચિમ રેલવે, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ - 360001 વેબસાઇટ ની વિગત: www.ireps.gov.in; ટેન્ડર નં.: DRM-RJT-24-25-SnT-E-09 તા. 12/07/2024; કામનું નામ: રાજકોટ ડિવિઝન: મેધા (વાણી રોડ (વીએનઆરડી) - બાલા રોડ (બીએવઆરડી) સેક્શન) રાજકોટ ડિવિઝનન વાણી રોડ (વીએનઆરડી) - બાલા રોડ (બીએલઆરડી) સેક્શનમાં 08 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોર્કિંગ સિસ્ટમ (મેધા મેક) મોડલ MEI633 માટે વ્યાપક વાર્ષિક જાળવર્ણ કરારની જોગવાઈનું ત્રણ વર્ષ માટે નવીકરણ.; <u>ટેન્ડરનો અંદાજીત ખર્</u>ય: ₹ 2,18,58,341.76 (ક બે કરોડ અઢાર લાખ અફાવન હજાર ત્રણ સે એકતાળીસ અને છોત્તેર પૈસા માત્ર); **અર્નેસ્ટમની** ડિપોઝીટ: ₹ 2,59,300/- (₹ બે લાખ ઓગણસાઈંઠ હજાર ત્રણસો માત્ર); <u>ટેન્ડર ફોર્</u>મ **ક્રી:** ₹ 00.00 (શૂન્ય) પેરા-3, GCC-જુલાઇ-2022 મુજબ; ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ અમને લાશક કरोः f facebook.com/WesternRly 🎗

જાહેર સૂચના અમદાવાદ મધ્યે ગુજરાતની ઉચ્ચ અદાલતમાં ૨જી. / સુધારા અ૨જી નં. ૧૯૨/૨૦૨૨

નિયત તારીખ : ૦૬/૦૮/૨૦૨૪ જિક્ષો:– અમદાવાદ

વિદ્રાન વકીલ શ્રી હેમલ શાહ અરજદાર (ઓ) તરફે મેરીકો લિમીટેડ

નરેન્દ્રસીંગ કીશોરસીંગ રાજપુરોહીત અને અન્યો મેસર્સ મનવાર પ્રોડક્ટ્સ તરીકે વ્યાપાર કરતા

૧. નરેન્દ્રસીંગ કીશોરસીંગ રાજપુરોહીત મેસર્સ મનવાર પ્રોડક્ટ્સ તરીકે વ્યાપાર કરતા

સરનામું - ૧૮/એલ/એલ, સત્તાધાર કોમ્પ્લેશ્વ, સી.પી.નગર ચાર રસ્તા, ઘાટલોડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧, ગુજરાત ચાર રસ્તા, વાટલાડાયા, અમદાયાદ-૩૦૦૦ ર, ગુજરાત. મોધ લેશો કે ઉપરોક્ત નામના અરજદાર(ઓ)એ આ હાઈકોર્ટમાં આરોધુયારા અરજી નંભર ૧૯૨/૨૦૨૨ (ભાપાર ચિન્હ અધીનિયમ, ૧૯૯૯ની કલમ ૫૦ હેઠળ) રજૂ દરેલ છે. જેમાં નરેન્દ્રસિંહ કિશોરસિંહ રાજુરોહિત કે જે – મેસર્સ મનવર મોડક્ટ્સના નામે વ્યાપાર કરતા હોય, ટ્રેડમાર્ક 'મનવર લેબલ' માટે વર્ગ ૦૩ માં નોધણી ક્રમાંક-૨૦૦૪૬૦૩ માં સુધારો કરવાની વિનંતી કરેલ છે.

કરવાના પલનતા કરલ છે. જ્યારે દીવાની અરજ (અવેજ સેવા માટે)નં, ૧/૨૦૨૪ ની સુનાવલી અને મંજૂરી આપવા પર આરસુધારા અરજ નં. ૧૯૨/૨૦૨૨ ને માનનીય અઠાલતે (કોરમ: એડીશ્રલ રજીસ્ટ્રાટ (ન્યાયિક)) તા સ્પંગ્રલ કરના રોજ દુકાય કહેલા કે જેને નોટીસ બજેલ નથી તેવા પ્રતિવાદી નંભર ૧ ને સ્થાનિક સમાચારપત્રમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જાહેર સૂચન પ્રકાશિત કરીને નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે. કે જે આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રસાર ધરાવતુ હોય અને જ્યાં ઉપરોક્ત નોટીસ નહી બજેલ પ્રતિવાદી નં.૧ છેક્ષે ખરેખર અને સ્વેચ્છાએ વસવાટ કરતા હોવાનું જાણવા મળેલ હોય`.

નોંધ લેશો કે ઉપરોક્ત રજી./ સુધારા અરજી ૧૯૨/૨૦૨૨ ની સુનાવલી **તારીખ ૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ્ સવારે ૧૧:૦૦** વાગ્યે આ અદાલતમાં અનિર્ક્ષિતપણે યોજાશે અને જો તમારા વત કોઈ હાજરી આપવામાં નહીં આવે તો, તમારા વકીલ અથવ તમારા માટે કાર્યવાહી કરવા માટે કાયદા દ્વારા અધિકૃત કોઈ વ્યક્તિ દ્વારા તમારી ગેરહાજરીમાં તેની સુનાવણી અને નિર્ધારણ કરવામાં આવશે.

અમદાવાદ ખાતેના મુખ્ય ન્યાયમૂર્તીથ્રી સુનીતા અગ્રવાલની સાક્ષ્યે, આજ રોજ તા.૨૫ મી જૂન, ૨૦૨૪ના દિવસે ઉપરોક્ત જણાવ્યું હતું. અદાલત દ્વાર

(કે. એમ. સુતરીયા) આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર

સરકારને ઘેરવાની તેયારી કરી રહી ભલામણોના આધારે લોન માફી છે. આ સિવાય કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓને ટાંકીને સેનાના જવાનોની શહાદતનો મુદ્દો પણ ઉઠાવશે અને સરકારની નીતિઓને નિષ્ફળ ગણાવશે. આ સાથે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને ચુંટણી કરાવવાને બદલે એલજીની સત્તા વધારવામાં આવે તો પણ સરકારને ઘેરવાની તૈયારીઓ ચાલી રહી છે. હકીકતમાં સરકારની નીતિઓને નિષ્ફળ ગણાવીને ભારતીય ગઠબંધન સાથે મળીને જમ્મુ-કાશ્મીર

, અને નીટ પેપર લીક, ખેડૂત- પણ ગૃહમાં માંગ કરશે. કોંગ્રેસ રહી છે. તે જ સમયે, મણિપુર, એમએસપી ગેરંટી, ટેકાના ભાવ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને ત્રિપુરામાં હિંસા અને ચીનના અતિૅક્રમણનો મુદ્દો ઉઠાવીને સરકારને રાષ્ટ્રવાદના મુદ્દે બેકફૂટ પર મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમને જેણાવી દઈએ કે લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શરણાર્થી શિબિરોમાં આશરો લઈ રહેલા લોકોને મળ્યા હતા. હવે કોંગ્રેસ આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહી છે. એકંદરે, રાહુલ ગાંધીએ આવા મુદ્દાઓ દ્વારા સમાજના વિવિધ વર્ગોને અપીલ કરીને સરકારને આડે હાથ લેવાની તૈયારી કરી છે, જ્યારે સરકાર પણ ડેટા સાથે વળતો પ્રહાર પર હુમલો કરવાની તૈયારીઓ ચાલી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

શ્રી ભાગવત વિદ્યાપીઠ બી. એડ્. કોલેજ, સોલા અમદાવાદ ભરતી માટેની જાહેરાત

ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત તેમજ યુ.જી.સી. માન્યતા પ્રાપ્ત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળ સંલગ્ન (સ્વનિર્ભર) શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, સોલા, અમદાવાદ માટે સંસ્કૃત માધ્યમમાં અધ્યાપન કરાવી શકે તેવા નીચે જણાવેલ જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી આવેદનપત્ર આમંત્રિત કરવામાં આવે છે

જગ્યાનું નામ :- (૧) આચાર્ચ -૧ (૨) આસી. પ્રોફેસર જગ્યા-૧ (વિષય :- સંસ્કૃત વ્યાકરણ-૧)

સૂચનાઓઃ (૧) નોકરી કરતા ઉમેદવારોએ સંસ્થાના વડા મારફત અરજે. મોકલવી. (૨) ઉમેદવારે પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન- ૨૧માં સંપૂર્ણ વિગતો સાથે ૨જી.એ.ડી.થી, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, શ્રી ભાગવત વિદ્યાપીઠ, કૃષ્ણ ધામ, એસ.જી. હાઇવે, મુ. સોલા, અમદાવાદ ને મોકલવાની રહેશે, સમય મર્યાદા બાદ આવેલ અરજી અમાન્ય રહેશે.(૩) અરજી કરવા માટેનું નિયત નમુનાનું ફોર્મ તથા જરૂરી સૂચના www.sbvtbedcollege.org વેબસાઈટ પરથી મળશે.(૪) નિમણૂંક પામના૨ ઉમેદવા૨ને યુ.જી.સી./ સ૨કા૨શ્રી/ युनिवर्सिटी तेमल संस्थाना वजतोवजतना जंधा नियमो जंधनङर्ता

કા. આચાર્ચ શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ મું .સોલા, અમદાવાદ

ADARSH PLANT PROTECT LIMITED CIN No.: L29210GJ1992PLC017845

Regd. Office: 604, GIDC Estate, V. U. Nagar – 388 121, Anand, Gujarat. Tel No.: (02692) 236705, Fax No.: (02692) 236704 Website: www.adarshplant.com Email: adarshplantprotect@gmail.com

NOTICE TO THE MEMBERS FOR 32nd ANNUAL GENERAL MEETING OF ADARSH PLANT PROTECT LIMITED (Company) TO BE HELD AT THE REGISTERED OFFICE 604, GIDC

ESTATE, V.U. NAGAR-388 121, ANAND.

1. Notice is hereby by given that the 32nd Annual General Meeting ('AGM') of the Company will be held physically on Saturday, the 14th day of September, 2024 at 11.00 a. M. (IST).

2. Pursuant to the above circulars, the Notice of the 32nd AGM, Standalone Financial Statements for the financial year 2023-24, along with Board's Report, Independent Auditors' Report and other documents required to be attached thereto, will be sent to the members whose email address are registered with the Company/Depository Participant(s). The aforesaid documents will also be available at Company's website (i.e. www.dasrablant.com and on the Bombay stock exchange's website where Company's securities are listed i.e. www.bseindia.com

3. The manner of casting vote through electronic mode:

a.) The Company is pleased to provide members the facility to exercise their right to vote on resolutions proposed to be considered at the 32nd Annual General Meeting by electronic means and the business may be transacted through e-Voting Services.

b.) The remote e-voting shall commence on Wednesday, 11th September, 2024 at 09:00 a.m. (IST) and shall end on Friday, 13th September, 2024 at 09:00 a.m. (IST) and shall end on Friday, 13th September, 2024 at 09:00 a.m. (IST) and shall end on Friday, 13th September, 2024 at 09:00 a.m. (IST) of Detailed instructions for e-voting given in the notice of the AGM which will be available at Company's website (www.adarabplant.com) and BSE's website (www.bseindia.com).

d.) The Company has engaged the services of NSDL as authorized e-voting agency and has made relevant arrangements with them for facilitating voting through electronic means. Hence notice of the AGM and e-voting instructions will be available at NSDL's website as well. (https://www.evoting.nsdl.com/)
e.) The members who have not cast their vote by remote e-voting prior to the AGM can cast their vote in

e.) The members who have not cast their vote by remote e-voting prior to the AGM can cast their vote in

AGM electronically.

4. The manner to get registered/updated email address:

a.) Kindly click/copy this link https://linkintime.co.in/EmailReg/EmailRegister.html and select your Company's name fill the mandatory details and update email Id and bank details in the given field, OR b.) Shares held in Demat mode: The shareholder can contact the Depository Participant ("DP") and register the email address and bank account details in the demat account as per the process followed and advised by the DP or by clicking above given link to update their details

5. The Register of Members and Share Transfer Book of the Company will remain closed from Sunday, 8th September, 2024 to Tuesday, 10th September, 2024 (both days inclusive) for the purpose of AGM. Cut-off date for the purpose of AGM is Saturday, 7th September, 2024.

6. The members are advised to go through all the notes carefully given in AGM notice for attending AGM and to cast their vote electronically.

Date: 17th July, 2024 Place: V. U. Nagar

For & on behalf of Adarsh Plant Protect Limite Managing Director

ADARSH PLANT PROTECT LIMITED Read, Office: 604, GIDC, VITTHAL UDYOGNAGAR - 388 121, DIST, ANANC CIN No. L29210GJ1992PLC017845 Website : www.ad Tel No. (02692) 236705 Fax No. (02692) 236704 Email ID : adarshplantprotect@gmail.cor

Extract of Audited Standalone Financial Results for the quarter ended 30th June, 2024 Year ended 31/03/2024 30/06/2024 Particulars 30/06/202 Un-audited Un-audited Audited et Profit / (Loss) for the period (before Tax, xceptional and/or Extraordinary items) -16.80 7.67 48.60 Net Profit / (Loss) for the period before tax (after 48.60 -16.80 7.67 et Profit / (Loss) for the period after tax (after otal Comprehensive Income for the period -16.80 7.67 48.60 Equity share capital arning per share (Face Value of Rs.10/- each)

NOTES:

1. The above results were reviewed and recommended by the Audit Committee and approved the Board of Directors in their meeting held on 17th July, 2024.

2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements Regulations, 2015.

3. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange www.bseindia.com and on the website of the Company www.adarshplant.com

4. Previous period's figures has been regrouped/ reclassified wherever required.

For Adarsh Plant Protect Lim

GUJARAT LEASE FINANCING LTD.

(CIN: L65990GJ1983PLC006345)

Regd. Office: 6th Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridge Ahmedabad-380 006. Ph: 079-26575722, E-mail: glflho_ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

EXTRACT OF THE STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024 (₹ in Lacs except per share data)

	(In Each except per share date				
Sl. No.	Particulars	Quarter ended	Year ended	Quarter ended	
		30.06.2024	31.03.2024	30.06.2023	
		(Un-audited)	(Audited)	(Un-audited)	
1	Total Income	10.27	48.01	10.15	
2	Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)	
3	Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)	
4	Total Comprehensive Income for the period (after tax)	(4.15)	11.56	(6.46)	
5	Equity Share Capital	2712.58	2712.58	2712.58	
6	Reserves excluding Revaluation Reserve as per Balance Sheet	-	(3128.05)	-	
7	Earnings Per Share (of ₹ 10/- each) Basic and Diluted	(0.02)	0.03	(0.02)	

Note: The above is an extract of the detailed financial results for the quarter ended June 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes, is available on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.gujaratleasefinancing.co.in.

Place: Ahmedabad Date: July 19, 2024

(૩) ભારતમાં અથવા અન્ય ખરીદદાર, વિક્રેતા, વેપારી, નિકાસકાર, આયાતકાર, વેપારીઓ,

<mark>૩. સૂચિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ ૧</mark>૨ ૧૬૯, શાકલી માંડલીકપુર રોડ, જુનીશંખલી, ગામ, જેતપુર, રાજકોટ-૩૬૦૩૭૦ ખાતેની ઓફિસમાં તપાસવામાં આવી શકે છે.